



પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ, English Expressionsમાં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું 'to go around in circles' એટલે 'ગોળ ચક્કર ફરતાં રહેવા વિશે.

મિત્રો, અંગ્રેજીમાં એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિના ભાગરૂપે બોલવામાં આવતાં 'to go around in circles' વિશે તમે કેટલું જાણો છો? ડોન્ટ વરી... હું તમને સમજાવું.

રોબ ફેફેઈને એરપોર્ટ મૂકવા જઈ રહ્યો છે. મિત્રો, શું તમને લાગે છે કે રોબને ફેફેઈને સમયસર એરપોર્ટ પહોંચાડી દેશે? કે પછી ફેફેઈ પોતાની ફ્લાઈટ ચૂકી જશે? રોબ કઈ દિશામાં જઈ રહ્યો છે? જાણવા બંનેને સાંભળો..

**Feifei**

Thanks for offering to drive me to the airport Rob.

**Rob**

No problem. It takes forever on the bus, so I thought I would save you some time.

**Feifei**

Thanks, but do you actually know the way to the airport?

**Rob**

Yes of course, why you asking?

**Feifei**

It's just we seem to be going round and round this roundabout. Rob, shouldn't you take that turning there?

**Rob**

No! That's where we just came from. Maybe it's this one... no, that can't be right.

પ્રેઝન્ટર

રોબ ફેફેઈને ક્યાં ફેરવી રહ્યો છે? મિત્રો, લાગે છે રોબને એરપોર્ટ જવાનો રસ્તો ખબર નથી! આગળ સાંભળો..

**Feifei**

Oh Rob! We're going round in circles!

**Rob**

Hmmm...

**Feifei**

We aren't getting anywhere! Come on Rob, I'm going to miss my flight.

**Rob**

Well done Feifei, you've just explained today's phrase – 'go round in circles' – although it's nothing to do with driving. If you do something for a long time without achieving any results and you always come back to the same problem, then you can describe the situation as 'going round in circles'.

પ્રેઝન્ટર

રોબ અને ફેફેઈ ફરી-ફરીને એક જ જગ્યાએ આવી જાય છે. બન્ને આગળ વધતાં જ નથી. મિત્રો, અંગ્રેજીમાં આ સ્થિતિને કહેવાય છે 'going round in circles.'

જો તમે સર્કલ ફરતે ચાલશો તો તમે એજ જ જગ્યાએ પાછા આવશો જ્યાંથી ચાલ્યા હતાં. આનો અર્થ થયો કે તમે આગળ વધ્યા જ નથી. આવી જ રીતે જો તમે કોઈ કામમાં વધારે પડતો સમય આપો તો પછી તમે કોઈ પ્રગતિ નથી કરી અને આ પરિસ્થિતિને કહીશું 'gone round in circles.'

જ્યારે વ્યક્તિ ઘણી મહેનત કર્યા બાદ ધાર્યું પરિણામ ન મેળવે તો એવી સ્થિતિમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તમે સાંભળો કે 'round in circles' બોલતી વખતે કેવી રીતે 'round' અને 'in' નું ઉચ્ચારણ કરવું. જો બન્ને શબ્દોને જોડી દેવામાં આવે છે તો સંભળાય છે 'roundin'.

હજુ કનફ્યુઝન છે? ચાલો થોડા ઉદાહરણો સાંભળીએ...

### **Examples**

*The politicians talked for hours but they couldn't come to an agreement; they were just going round in circles.*

*I've been going round in circles trying to find the right person to talk to about getting a refund on my ticket but with no success. I give up!*

*Because we didn't have the data from the survey, we went round in circles discussing the same old problems.*

**Feifei**

So 'going round in circles' means not getting anywhere – and Rob, we're not getting anywhere today – and I need to get to the airport.

**Rob**

Ok, don't panic. It's definitely... errr... this way.

**Feifei**

Careful!

**Rob**

Now you see, we're not going round in circles. We're going in the right direction... we're on the right road... we're making progress.

**Feifei**

At last we're making progress! No more going round in circles.

**Rob**

Oh no... hold on...

**Feifei**

What is it Rob?

**Rob**

Another roundabout! Which way now?

**Feifei**

Hmm, take my advice: if you don't want to go round in circles, get organised: take the bus!

**Rob**

Sorry Feifei. There's another flight tomorrow.

પ્રેઝન્ટર

ઓહ નહીં! રોબ માત્ર 'going round in circles' કરતો રહ્યો જેના કારણે ફેફેઈ બસ ચૂકી ગયા! આશા રાખીએ કે ફેફેઈ એરપોર્ટ પર સમયસર પહોંચી જાય. આવા જ બીજા રસપ્રદ ટોપિક્ સાથે ફરીથી મળીશું English Expressions માં. ત્યાં સુધી Bye!